

## (૧) વ્યવસ્થા તંત્ર, કાર્યો અને ફરજો

### ઈ-ગવર્નન્સ ખાતુ / ઈ.ડી.પી. ખાતુ

નામ	ઓફિસ ફોન.નં.	રહેઠાણ ફોન નં.	મોબાઇલ નં.
શ્રી પ્રવિષ્ટ ચૌધરી (IAS) કે.મ્યુનિ.કમિશનર (ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯		૮૭૪૮૮૦૨૭૧
શ્રી યતીન્દ્ર નાયક આસી.મ્યુનિસિપલ કમિશનર (ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯		૮૩૨૭૦૩૮૮૦૦
શ્રી પૃથ્વીરાજસિંહ જાલા ડાયરેક્ટર (ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯		૮૭૧૨૭૭૦૦૪૮
શ્રી પિયુષ ઠાકર ઈન્યાર્જ મેનેજર (ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯		૮૩૨૭૫૧૩૪૬૬
શ્રી કૌશિક મકવાણા આસી.મેનેજર (ઈ-ગવર્નન્સ)	૨૫૩૮૯૮૯૯		૮૮૭૯૦૧૨૬૮૮
શ્રી સલમાન અધ્યાસી ઈન્યાર્જ/સિસ્ટમ એનાલીસ્ટ	૨૫૩૮૯૮૯૯		૮૮૭૮૫૬૩૩૨૧
શ્રી પી. આર. કાયસ્થ સિસ્ટમ એન્જિનીયર	૨૫૩૮૯૮૯૯/૫૫૧		૮૩૭૭૪૮૨૪૦૩
શ્રી ડી. પી. પંડ્યા જુનીયર સિસ્ટમ એન્જિનીયર	૨૫૩૮૯૮૯૯/૫૫૧		૮૭૧૨૮૭૦૮૮૭
મેઈન સર્વર રૂમ: મેઈન સર્વર ઓપરેટર		૨૭૫૫૧૭૬૮, ૨૭૫૫૧૮૬૫	

### સિવિક સેન્ટરોની યાદી:

#### સમય

કેટેગરી-A :	કુલ	:	૦૭	સવારે ૮ થી સાંજના ૭.૩૦ કલાક સુધી
કેટેગરી-B :	કુલ	:	૦૫	સવારે ૮ થી સાંજના ૭.૩૦ કલાક સુધી
કેટેગરી-C :	કુલ	:	૧૭	સવારે ૮ થી સાંજના ૫ કલાક સુધી
કેટેગરી-D :	કુલ	:	૧૮	સવારે ૮ થી સાંજના ૫ કલાક સુધી
કેટેગરી-E :	કુલ	:	૧૭	સવારે ૮ થી સાંજના ૫ કલાક સુધી

**મધ્ય ઝોન:**

૧.	રીલીફ રોડ સિવિક સેન્ટર (Category-A) ખુનિ.શાળાના મકાનમાં, રૂપમ સિનેમા સામે, રીલીફ રોડ, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૬૮
૨.	ગીરધરનગર સિવિક સેન્ટર (Category-C) ગીરધરનગર વોર્ડ ઓફિસ, કિર્તી એપાર્ટમેન્ટ પાછળ, પ્રિતમપુરા ખુનિ.શાળા નં.૩-૪ પાસે, કાનજીનગર ચાર રસ્તા, ગીરધરનગર, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૦૮
૩.	ખાડીયા સિવિક સેન્ટર (Category-C) જુના આંગારીયા નાકા, મહિપતરામ આશ્રમ સામે, રાયપુર દરવાજાની બાજુમાં, ખાડીયા, અમદાવાદ.	૮૦૬૬૦૮૩૦૭૭
૪.	દૂષેશ્વર સિવિક સેન્ટર (Category-C) દૂષેશ્વર સબ ઝોનલ ઓફિસ, દૂષેશ્વર વોટર વર્ક્સ કુપાઉન્ડ, શાહીબાગ, અમદાવાદ.	૮૭૨૬૪૯૫૮૦૧
૫.	જમાલપુર સિવિક સેન્ટર (Category-D) જમાલપુર સબ ઝોનલ ઓફિસ, જે.પી.સ્ટોર, એ.એમ.ટી.એસ. સ્ટાફ ક્વાર્ટર્સ સામે, જમાલપુર, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૭૧
૬.	દરીયાપુર સિવિક સેન્ટર (Category-D) દરીયાપુર વોર્ડ ઓફિસ, કુટી મસ્જિદ પાસે, રૂપારાણીની પોળ પાસે, દરીયાપુર દરવાજા, અમદાવાદ.	૮૭૨૬૪૯૫૮૦૧
૭.	શાહપુર સિવિક સેન્ટર (Category-C) શાહપુર વોર્ડ ઓફિસ, બાપુ સ્મૃતિકુંજ રોડ સ્ટોરની બાજુમાં, શાહપુર દરવાજા પાસે, અમદાવાદ.	૮૭૨૬૪૯૫૮૦૧
૮.	અસારવા સિવિક સેન્ટર (Category-C) નરોડા રોડ વોર્ડ ઓફિસ, રેન બસેરા, ચમનપુરા સર્કલ, ચામુંડા ઓવરબ્રિજ, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૦૮
૯.	સરદારભાગ સિવિક સેન્ટર (Category-A) રૂપાલી સિનેમાની બાજુમાં, સરદારભાગની સામે.	૮૦૬૬૦૮૩૦૭૭

**પદ્ધતિ જોન:**

૧૦.	લો-ગાર્ડન સિવિક સેન્ટર (Category-A) ગુજરાત લો સોસાયટી મેઈન ગેટની સામે, એલીસબ્રીજ, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૬૪
૧૧.	ઉસ્માનપુરા સિવિક સેન્ટર (Category-A) ડૉ. રમણભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા ચાર રસ્તા આશ્રમ રોડ, અમદાવાદ.	૮૭૨૬૪૯૫૮૪૮
૧૨.	વાસણા સિવિક સેન્ટર (Category-C) વાસણા સ્વીમીંગ પુલ બીલીંગ, ગોદાવરી ફ્લેટની સામે, વાસણા, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૭૫
૧૩.	નવા વાડજ સિવિક સેન્ટર (Category-D) નવા વાડજ સબ ઝોનલ ઓફિસ, પુરુષોત્તમ નગર, પાર્થ ટાવરની સામે, નવા વાડજ, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૦૧
૧૪.	ધરણીધર સિવિક સેન્ટર (Category-C) કે.કે શાસ્ક્ની વાંચનાલય, ધરણીધર ટેરાસર સામે, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૭૫
૧૫.	આંબાવાડી સિવિક સેન્ટર (Category-E) ગાંધીગ્રામ સબ ઝોનલ ઓફિસ, હિંમતલાલ પાર્ક પાસે, આજાદ સોસાયટી, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૪૫
૧૬.	સરદાર પટેલ સ્ટેડીયમ સિવિક સેન્ટર (Category-D) સરદાર પટેલ સ્ટેડીયમ વોર્ડ ઓફિસ, નારણપુરા કોસીંગ પાસે, પંચશીલ સોસા.પાસે, નારણપુરા, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૬૫
૧૭.	નારણપુરા સિવિક સેન્ટર (Category-E) નારણપુરા વોર્ડ ઓફિસ, કામેશ્વર મહાદેવ મંદિર પાસે, નારણપુરા, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૬૫
૧૮.	ચાંદખેડા સિવિક સેન્ટર (Category-C) ચાંદખેડા વોર્ડ ઓફિસ, જુની ચાંદખેડા નગરપાલિકા ઓફિસ, ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે, ઇનસાઈડ ચાંદખેડા ગામ, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૬૮

૧૯.	સાબરમતી સિવિક સેન્ટર (Category-D) સાબરમતી સબ ઝોનલ ઓફિસ, ટોરેન્ટ પાવર સ્ટેશન સામે, સાબરમતી, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૬૮
૨૦.	રાણીપ સિવિક સેન્ટર (Category-C) રાણીપ વૉર્ડ ઓફિસ, જૂનું નગરપાલિકા બીઠીગા,મહેશ પાર્ટી પ્લોટ સામે, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૮૧
૨૧.	કાળી સિવિક સેન્ટર (Category-E) કાળી વૉર્ડ ઓફિસ, કાળીગામ, પોર્ટ ડિંગવીજ્યનગર, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૮૧

### પૂર્વ ઝોન:

૨૨.	વિરાટનગર ટેક કલેકશન સેન્ટર (Category-B) હરુભાઈ મહેતા ભવન, વિરાટનગર ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૩૮
૨૩.	રાજપુર સિવિક સેન્ટર (Category-D) રાજપુર સબ ઝોનલ ઓફિસ, ચકુઠીયા મહાદેવ પાસે, બળીયાકાક રોડ, રાજપુર, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૯૩
૨૪.	મહાવીરનગર સિવિક સેન્ટર (Category-D) મહાવીરનગર વૉર્ડ ઓફિસ, ઇનસાઈડ જુના એ.એમ.ટી.એસ.અપો, એક્તા એપાર્ટમેન્ટ સામે, હાટકેશ્વર, સી.ટી.એમ.રોડ, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૫૬
૨૫.	ગોમતીપુર સિવિક સેન્ટર (Category-E) ગોમતીપુર વૉર્ડ ઓફિસ, ગોમતીપુર રેફરલ હોસ્પિટલ પાસે, ખુનિસિપલ બાલ ભવન, ગોમતીપુર દરવાજા સામે, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૯૯૩

૨૬.	અર્બુદાનગર સિવિક સેન્ટર (Category-D)	૫૭૨૬૪૧૬૯૩૮
	કવિ રમણલાલ વસંતલાલ દેસાઈ લાયબ્રેરી ભવન, કિઝાપાર્ક ટ્યુબવેલની બાજુમાં, સુખનન ગાડીન પાસે, હિન્દુસ્તાન માર્બલ રોડ, નિકોલ, અમદાવાદ.	
૨૭.	અમરાઈવાડી સિવિક સેન્ટર (Category-D)	૫૭૨૬૪૧૬૯૪૫
	અમરાઈવાડી સબ ઝોનલ ઓફિસ, મથુર માસ્ટર ચાર રસ્તા પાસે, ૧૩૨ કુટ રીગ રોડ, અમરાઈવાડી, અમદાવાદ.	
૨૮.	વસ્ત્રાલ સિવિક સેન્ટર (Category-E)	૫૭૨૬૪૧૬૯૩૪
	વસ્ત્રાલ વૉર્ક ઓફિસ, અજય ટેનામેન્ટ વિભાગ-૫ ની બાજુમાં, ગંટ નં. ૩, આર.ટી.ઓ. ઓફિસ સામે, નાની કેનાલ પાસે, વસ્ત્રાલ રોડ, મહાદેવનગર, અમદાવાદ.	
૨૯.	ઓફવ સિવિક સેન્ટર (Category-C)	૫૭૨૬૪૧૬૯૪૫
	ઓફવ વૉર્ક ઓફિસ, રબારી વસાહત પાસે, ઓફવ ફાયર સ્ટેશનની બાજુમાં, ઓફવ, અમદાવાદ.	
૩૦.	નિકોલ સિવિક સેન્ટર (Category-E)	૫૭૨૬૪૧૬૯૩૪
	બેટી બચાવો ગ્રાઉન્ડ સામે, નિકોલ, અમદાવાદ.	
૩૧.	રામોલ હાથીજણ સિવિક સેન્ટર (Category-C)	૫૭૨૬૪૧૬૯૧૯
	હાથીજણ સર્કલની બાજુમાં, હાથીજણ અમદાવાદ	
૩૨.	કંઠવાડા સિવિક સેન્ટર (Category-D)	૫૭૨૬૪૧૬૯૩૪
	ગ્રામ પંચાયતની ઓફિસ કંઠવાડા,	

### દક્ષિણ ઝોન:

૩૩.	મણીનગર સિવિક સેન્ટર (Category-A)	૫૭૨૬૪૧૬૯૪૨
	દક્ષિણ ઝોન ઝોનલ ઓફિસ, મણીનગર ફાયર સ્ટેશનની સામે, રામભાગ, મણીનગર, અમદાવાદ.	

૩૪.	ઈસનપુર સિવિક સેન્ટર (Category-B)	૫૭૨૬૪૧૬૧૭૮
	ઈસનપુર વોર્ડ ઓફિસ, પાણીની ટાંકી પાસે, ગ્રાજ હોસ્પિટલની સામે, રામવાડી, ઈસનપુર, અમદાવાદ.	
૩૫.	ઇન્દ્રપુરી સિવિક સેન્ટર (Category-B)	૫૭૨૬૪૧૬૧૫૬
	ઇન્દ્રપુરી વોર્ડ ઓફિસ, એક્સપ્રેસ હાઇ-વે પાસે, સી.ટી.એમ. ચાર રસ્તા, અમદાવાદ.	
૩૬.	કાંકરીયા સિવિક સેન્ટર (Category-C)	૫૭૨૬૪૧૬૧૦૩
	કાંકરીયા વોર્ડ ઓફિસ, ખુનિ.સ્કૂલ પાસે, પારસી અગિયારી પાસે, વેદ મંદિર રોડ, કાંકરીયા, અમદાવાદ.	
૩૭.	ઘોડાસર સિવિક સેન્ટર (Category-E)	૫૭૨૬૪૧૬૧૭૮
	ઘોડાસર વોર્ડ ઓફિસ, રાજેશ્વરી સોસાયટી, ચંડોળા તળાવ પાસે, ઘોડાસર, અમદાવાદ.	
૩૮.	વટવા સિવિક સેન્ટર (Category-E)	૫૭૨૬૪૧૬૧૧૬
	વટવા વોર્ડ ઓફિસ, વટવા ગામ, અમદાવાદ.	
૩૯.	બહેરામપુરા સિવિક સેન્ટર (Category-E)	૫૭૨૬૪૧૬૧૭૧
	બહેરામપુરા વોર્ડ ઓફિસ, ટોરેન્ટ પાવર સબસ્ટેશનની બાજુમાં, ખોડીયારનગર ચાર રસ્તા, બહેરામપુરા, અમદાવાદ.	
૪૦.	ખોખરા સિવિક સેન્ટર (Category-D)	૫૭૨૬૪૧૬૧૦૩
	ખોખરા સર્કલ, રોકડીયા હનુમાનની બાજુમાં, ખોખરા, અમદાવાદ.	
૪૧.	લાંબા સિવિક સેન્ટર (Category-E)	૫૭૨૬૪૧૬૧૧૬
	લાંબા વોર્ડ ઓફિસ, નારોલ ગામ	

## ઉત્તર ઝોનાઃ

૪૨.	મેઝ્કો સિવિક સેન્ટર (Category-A) રાજીવ ગાંધી ભવન, નરોડા રોડ, મેઝ્કો ચાર રસ્તા પાસે, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૫૭
૪૩.	રખીયાલ સિવિક સેન્ટર (Category-B) વિમલભાઈ ભુનિસિપલ લાયબ્રેરી ભવન, રખીયાલ ચાર રસ્તા, અમદાવાદ.	૮૭૨૬૪૯૫૮૪૪
૪૪.	નરોડા સિવિક સેન્ટર (Category-C) નરોડા મુઠીયા વોર્ડ ઓફિસ, નરોડા ગામ, નરોડા, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૭૪
૪૫.	સરદારનગર સિવિક સેન્ટર (Category-C) સરદારનગર લાયબ્રેરી ભવન, સરદારનગર પોલીસ સ્ટેશન પાસે, સરદારનગર, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૫૪
૪૬.	સરસપુર સિવિક સેન્ટર (Category-C) સરસપુર બાલ ભવન, કે.કે.આઈ.હોસ્પિટલ, સરસપુર, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૦૮
૪૭.	કુબેરનગર સિવિક સેન્ટર (Category-E) કુબેરનગર સબ જોનલ ઓફિસ, સી-વોર્ડ પાણીની ટાંકી પાસે, સરદારગ્રામ રેલવે સ્ટેશન સામે, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૫૪
૪૮.	નોબલનગર સિવિક સેન્ટર (Category-C) નોબલનગર વોર્ડ ઓફિસ, EWS કવાટર્સની બાજુમાં, ભગવતી ફ્લોરમીલ પાસે, નરોડા પોલીસ સ્ટેશન સામે, નરોડા, અમદાવાદ.	૮૭૨૬૪૯૬૧૭૭
૪૯.	ઈન્દીયા કોલોની સિવિક સેન્ટર (Category-E) ઈન્દીયા કોલોની વોર્ડ ઓફિસ, પોટલીયા અર્બન હેલ્પ સેન્ટર કંપાઉન્ડ, ચંદ્રમસાદ દેસાઈ હોલ સામે, બાપુનગર, અમદાવાદ.	૮૭૨૬૪૯૫૮૪૪

૫૦. બાપુનગર સિવિક સેન્ટર  
 (Category-D)  
 અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં, મરધા ફાર્મ રોડ,  
 વિરાટનગર ચાર રસ્તા પાસે,  
 બાપુનગર, અમદાવાદ.

૫૧. ઠક્કરબાપાનગર સિવિક સેન્ટર  
 (Category-E)  
 ઠક્કરબાપાનગર વર્ડ ઓફિસ

૫૨. નાના ચીલોડા સિવિક સેન્ટર  
 (Category-D)  
 ગ્રામપણ્યાયતની ઓફિસ નાના ચીલોડા

#### દક્ષિણ પશ્ચિમ ઝોન:

૫૩. વેજલપુર સિવિક સેન્ટર  
 (Category-C)  
 વેજલપુર વર્ડ ઓફિસ,  
 જલતરંગ પોલીસ સ્ટેશન સામે, અમદાવાદ.

૫૪. જોધપુર સિવિક સેન્ટર  
 (Category-D)  
 જોધપુર વર્ડ ઓફિસ,  
 જૂની નગર પાલિકા ઓફિસ,  
 રામજ મંદિર પાસે, જોધપુર ગામ, અમદાવાદ.

૫૫. સરખેજ સિવિક સેન્ટર  
 (Category-E)  
 સરખેજ વર્ડ ઓફિસ,  
 જૂની નગર પાલિકા ઓફિસ,  
 પાણીની ટાંકી પાસે, સરખેજ ગામ, અમદાવાદ.

૫૬. મકતમપુરા સિવિક સેન્ટર  
 (Category-D)  
 મકતમપુરા વર્ડ ઓફિસ,  
 APMC માર્કેટ ની બાજુમાં, અમદાવાદ.

૫૭. બોપલ સિવિક સેન્ટર  
 (Category-C)  
 સોબો ગાર્ડનની પાસે, જુની ઔડા ઓફિસ,  
 બોપલ, અમદાવાદ.

## ઉત્તર પશ્ચિમ ઝોન:

૫૮.	બોડકટેવ સિવિક સેન્ટર (Category-A)	૯૭૧૨૮૬૭૩૧૩
	અતિથિ ડાયનીગ હોલ પાસે, દીપ. ટાવર પાસે, ઈનસાઇડ શ્રદ્ધા પેટ્રોલ પંપ, બોડકટેવ, અમદાવાદ.	
૫૯.	ચાંદલોડીયા સિવિક સેન્ટર (Category-B)	૯૭૨૬૪૧૫૮૦૨
	ચાંદલોડીયા પ્રાયમરી સ્કૂલ, ચાંદલોડીયા, અમદાવાદ.	
૬૦.	ઘાટલોડીયા સિવિક સેન્ટર (Category-B)	૯૭૨૬૪૧૫૮૦૨
	ઘાટલોડીયા વોર્ડ ઓફિસ, ચાણકય બ્રીજ નીચે, પ્રભાત ચોક પાસે, ઘાટલોડીયા, અમદાવાદ.	
૬૧.	મેમનગર સિવિક સેન્ટર (Category-C)	૯૭૨૬૪૧૬૧૭૦
	બોડકટેવ વોર્ડ ઓફિસ, જૂની નગરપાલિકા ઓફિસ, માનવ મંદિર પાસે, મેમનગર ગામ, અમદાવાદ.	
૬૨.	ગોતા સિવિક સેન્ટર (Category-E)	૯૭૨૬૪૧૬૧૮૧
	ગોતા વોર્ડ ઓફિસ, સાયન્સ સીટી રોડ, અમદાવાદ.	
૬૩.	થલતેજ સિવિક સેન્ટર (Category-E)	૯૭૨૬૪૧૬૧૭૦
	આઈના કોમ્પ્લેક્સ પાસે, કોલંબીયા એશીયા હોસ્પિટલ પાસે, થલતેજ, અમદાવાદ.	
૬૪.	આર.ટી.ઓ. વ્હીકલ ટેક કલેક્શન સેન્ટર આર.ટી.ઓ.કેમ્પસ, સુભાષ બ્રીજ, અમદાવાદ.	૯૭૨૬૪૧૬૧૦૧

## (૨) અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યો અને ફરજો

ક્રમ	જગાનું નામ / હોદ્ડો	અધિકારી / કર્મચારી પાસેથી લેવામાં આવતી કામગીરી
૧	મેનેજર	<ul style="list-style-type: none"> <li>મેનેજર ખાતાના હેડ ગાળાશે અને ઈ-ગવરનન્સ ખાતાનો સંપૂર્ણ ચાર્જ તેમની પાસે રહેશે.</li> <li>૩.મ્યુનિ.કમિ.(ઈ-ગવરનન્સ)શ્રીની સીધી દેખરેખ હેઠળ ખાતાની સમગ્ર કામગીરીનું સંચાલન, સુપરવીઝન, માર્ગદર્શન અને અંકુશ તેમજ સમયાંતરે ભૂનિ. કમિ. શ્રી / ૩.મ્યુનિ. કમિ.શ્રી દ્વારા સોંપવામાં આવતી ફરજ બજાવવાની રહેશે.</li> </ul>
૨	આસી. મેનેજર-૧  આસી. મેનેજર-૨	<ul style="list-style-type: none"> <li>ખાતાના વહીવટી તેમજ ટેકનીકલ એડમીનિસ્ટ્રેશનની કામગીરી કરવાની રહેશે.</li> <li>સીટી સીવીક સેન્ટરોનું સંચાલન.</li> <li>ઈ-ગવરનન્સ ખાતાના તમામ ટેકનીકલ અને એડમીનિસ્ટ્રેટીવ ઈસ્યુઓનું મેનેજમેન્ટ તેમજ એડમીનિસ્ટ્રેટીવ પ્રોસીજરની દેખરેખ રાખી અન્ય ટીપાર્ટમેન્ટ સાથે જરૂરી કોમ્પ્યુનીક્શન એસ્ટાબ્લિશ કરી જે તે ખાતાના પ્રોબ્લેમ્સ અને તેનું નિરાકરણ કરવા સારુ મેનેજરશ્રી સાથે મેનેજમેન્ટ કરવું.</li> <li>ઈ-ગવરનન્સ ખાતાની સ્ટેશનરી અને મશીનોની ઈન્વેન્ટરીનું મેનેજમેન્ટ કરવું.</li> </ul>
૩	ઈન્ચાર્જ / સીસ્ટમ એનાલીસ્ટ	<ul style="list-style-type: none"> <li>ભૂનિ. કોરોનિશન દ્વારા નવી સિસ્ટમના ડેવલપમેન્ટની સિસ્ટમ સ્ટડી, સિસ્ટમ ડીજાઇન તેમજ ડેટા ફ્લો ડીજાઇનની કામગીરી અને તે અનુસાર જે તે પ્રોગ્રામરશ્રીઓ માર્કિટ જરૂરી પ્રોગ્રામ ડેવલપ કરવી સિસ્ટીમ સંપૂર્ણપણે અમલીકૃત કરવવી.</li> <li>ઈન્ચાર્જ/સિસ્ટમ એનાલીસ્ટશ્રીએ ડીજાઇન ઉપરાંત સીસ્ટીમ મેઈન્ટેનન્સની કામગીરી, પ્રોગ્રામરશ્રીની કામગીરીનું મુલ્યાંકન તેમજ જરૂર જણાય ત્યાં તેઓએ તેમની કામગીરીમાં માર્ગદર્શન આપવું.</li> <li>સર્વરરૂમ ખાતે વેબસાઈટ અધ્યતન રાખવી, જે તે ખાતાના સૂચના મુજબ સોફ્ટવેર અધ્યતન/અપડેટ કરાવવું, મેલ સર્વર ડેટાબેઝ બેકઅપ વગેરે કામગીરીની દેખરેખ રાખવી.</li> </ul>
૪	સિસ્ટમ એન્જિનીયર	<ul style="list-style-type: none"> <li>કોમ્પ્યુટર મશીનોનું રીપોર્ટિંગ, મેઈન્ટેનન્સ, કોમ્પ્યુટર સિસ્ટમોનું ઈન્સ્ટોલેશન, સોફ્ટવેર ઈન્સ્ટોલેશન સીસ્ટીમ શીફ્ટાઉંગ તેમજ જુ. સીસ્ટીમ એન્જિનીયરશ્રીની કામગીરીમાં માર્ગદર્શન કરવાનું રહેશે.</li> <li>તમામ પ્રકારના હાઉન્ડર, તેના ઈસ્યુ, વપરાશ, મેઈન્ટેનન્સ વગેરેની કામગીરી કરવી.</li> <li>જરૂરી મશીનો ખરીદવાની એડમીનિસ્ટ્રેટીવ પ્રોસીજર જેવી કે ટેન્ડર ફ્લોટાઉંગ, ટેન્ડર એનાલીસીસ અને ટેન્ડરનું પૃથ્વકરણ કરી જરૂરી કમ્પેરેટીવ (ટેકનીકલ કોમેન્ટ સાથે) ખાતાના અધિકારીશ્રીને સબમીટ કરવું.</li> </ul>
૫	જુની. સીસ્ટમ એન્જિનીયર	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવરનન્સ ખાતા દ્વારા ઈન્સ્ટોલ કરાયેલ અને અમદાવાદ ભૂનિ. કોરોનિશન દ્વારા ખરીદાયેલા કોમ્પ્યુટરોનું જરૂરી રીપોર્ટિંગ કરવું.</li> <li>તમામ પ્રકારના હાઉન્ડર, તેના ઈસ્યુ, વપરાશ, મેઈન્ટેનન્સ વગેરેની કામગીરી કરવી.</li> <li>સિસ્ટમ એન્જિનીયરશ્રી તથા ખાતાના અધિકારીઓશ્રી દ્વારા સોંપાયેલ કામગીરી કરવી.</li> </ul>
૬	જુની. પ્રોગ્રામર	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવરનન્સ ખાતાના ઈન્ચાર્જ /સીસ્ટમ એનાલીસ્ટશ્રી તથા આસી. મેનેજરશ્રી દ્વારા અપાયેલ પ્રોગ્રામીંગની કામગીરી કરવી.</li> <li>સીસ્ટમનું જરૂરી મેઈન્ટેનન્સ કરી જે તે જરૂરી રીપોર્ટો ઈન્ચાર્જ /સીસ્ટીમ એનાલીસ્ટશ્રીના માર્ગદર્શન હેઠળ બનાવવા.</li> <li>જરૂરી પ્રોસેસોંગની સૂચનાઓ કોમ્પ્યુટર ઓપરેટરશ્રીઓને આપવી.</li> <li>ટેક્ષ વિભાગની ઓનલાઈન રીકવરી સીસ્ટમમાં ટેક્ષ વિભાગની માંગણી અનુસાર જરૂરી પ્રોગ્રામીંગ કરી રીપોર્ટ જનરેશન, ડેટા એન્ટ્રી મોડ્યુલ, ચેકલિસ્ટ પ્રિન્ટિંગ પ્રોવીઝન કીએટ કરવા.</li> </ul>

૭	કોમ્પ્યુટર ઓપરેટર	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતામાં ચાલતી તમામ સીસ્ટમોનું પ્રોસેસીંગ વર્ક જુની. પ્રોગ્રામરશ્શીના માર્ગદર્શન હેડળ કરવી.</li> <li>જુદી જુદી સીસ્ટમોના નીકળતા રીપોર્ટ્સનું જરૂરી પ્રિન્ટીંગ કરી જે તે ડીપાઇમેન્ટને આ અંગેની જાણ કરવી.</li> <li>રોજ રોજ જે તે સીસ્ટીમોના ડેટાનો બેક અપ લેવો અને તેને મેઈન્ટેઇન કરવો.</li> <li>ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા સોંપાયેલ કામગીરી કરવી.</li> </ul>
૮	ડી.ટી.પી. ઓપરેટર	<ul style="list-style-type: none"> <li>ઘુનિ. કમિશનરશ્રી અને ડે. ઘુનિ. કમિશનરશ્રીઓના ઓફિસ વર્કના જરૂરી ડૉક્યુમેન્ટ્સને કોમ્પ્યુટરમાં એન્ટર કરવા</li> <li>ઘુનિ. કોર્પોરેશનના જુદા જુદા પ્રોજેક્ટનું પ્રોજેક્શન કોમ્પ્યુટર દ્વારા જરૂરી માર્ગદર્શન પ્રમાણે કરવું</li> <li>ગુજરાતી કે અંગ્રેજીમાં જરૂર હોય તે પ્રમાણે અધિકારીશ્રીની સૂચના મુજબ કામગીરી કરવી.</li> </ul>
૯	જુની. કોમ્પ્યુટર ઓપરેટર	<ul style="list-style-type: none"> <li>પે-રોલ સીસ્ટમના ડેટાના પ્રોગ્રામના રન કરવા તથા પ્રોસેસીંગ જેવા કે ચેકલીસ્ટ, અપડેટીંગ, વેલિડેશન, કરેક્શન વિગેરે કરવા તથા તેનું પ્રિન્ટીંગ કરવું, ટમનિલ / પ્રિન્ટર સેટીંગ તથા મેઈન્ટેનન્સ</li> <li>જુદી જુદી સીસ્ટમો જેવી કે વ્હીકલ ટેક્ષમાં બીલ, ડીમાન્ડ, બીલ ઈસ્યુ રજસ્ટર, સમરી તૈયાર કરી પ્રિન્ટ કરવા. વોટર મીટર સીસ્ટમમાં બીલ, ડીમાન્ડ, રીડિંગ રજસ્ટર પ્રોસેસીંગ કરી પ્રિન્ટ કરવા અને પ્રોપર્ટી ટેક્ષ સીસ્ટમમાં બીલ, ડીમાન્ડ, ઈસ્યુ રજસ્ટર, રેકવીઝિશન ફોર્મ, સ્લીપ ડીમાન્ડ સમરી વગેરેનું પ્રોસેસીંગ કરી પ્રિન્ટ કરવા.</li> <li>જુદા જુદા ખાતામાંથી આવત પ્રિન્ટીંગ જેવા કે પેન્શન, બજેટ, પી.એફના પ્રિન્ટીંગ જરૂરીયાત અને સૂચના મુજબ કાઢી આપવા તથા સક્ષમ અધિકારીશ્રી તરફથી સોંપાતી કામગીરી કરવી</li> <li>સર્વર અપલોડીંગ તેમજ નિયમિત રીપોર્ટ જનરેશન, સમરી રીપોર્ટ જનરેશન</li> </ul>
૧૦	ડેટા એન્ટ્રી ઓપરેટર	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતામાં ચાલતી વિવિધ સીસ્ટમો માટે જરૂરી ડેટા એન્ટ્રી જે તે પ્રોગ્રામ અનુસાર કરવી</li> <li>આ અંગે જરૂરી ડેટા એકત્ર કરી સુપરવાઈઝરને આપવો</li> </ul>
૧૧	ઓફિસ સુપ્રેન્ટેન્ટ સીનીયર કલાર્ક	<ul style="list-style-type: none"> <li>વહીવટી વિભાગનું સંચાલન, કામગીરી સરળતાથી ચાલે તે માટે તથા કર્મચારીઓની હાજરી પત્રક પરથી તેઓની સી.એલ., ઈ.એલ., મેરીકલ તથા અન્ય રજાઓ ભરવાની કામગીરી કરવી.</li> <li>જૂના ઓડીટ વાંધાઓના નિકાલ કરવાની કામગીરી કરવી.</li> <li>મેનેજરશ્રી અને આસી.મેનેજરશ્રી તરફથી સોંપાતી તમામ કામગીરી કરવી.</li> <li>ઈમ્પ્રેશ કેશ તથા તેના હિસાબની જાળવણી કરવી.</li> <li>ઈ-ગવર્નન્સ ખાતામાં આવતા બીલોના પેમેન્ટ અંગેના ચેકો માટે પાર્ટીને ચેક ચૂકવવાની તથા તેમની પાસેથી રીસીપ્ટ મેળવી તે અંગેના પેમેન્ટની કામગીરી કરવી તથા ઓફિસર્સને માહિતી આપવી.</li> <li>કર્મચારીઓનું હાજરી પત્રક નિયમિત ચકાસવું.</li> </ul>
૧૨	જુની. કલાર્ક	<ul style="list-style-type: none"> <li>ઈ-ગવર્નન્સ ખાતુ તથા ઈ-ગવર્નન્સ ખાતાના પત્રો તથા ફાઇલોના ઈનવર્ક તથા આઉટવર્ક અંગેની તમામ કામગીરી કરવી.</li> <li>મેનેજરશ્રી તથા આસી.મેનેજરશ્રી અને ખાતાના અધિકારીશ્રીઓ જે કામગીરી બતાવે તે કામગીરી કરવી.</li> <li>પે-રોલ ના જરૂરી પત્રકો મેળવી રી-પ્રિન્ટ અંગેની કામગીરી કરવી.</li> <li>ઈ-ગવર્નન્સ ખાતાના બીલ કલાર્કની તમામ કામગીરી, સર્વિસ બુકોની નિભાવણી કરવી.</li> <li>વહીવટી કામગીરી કરવી.</li> <li>સીની. કલાર્કશ્રીની કામગીરીમાં મદદ કરવી તથા અન્ય કલાર્કની ગેરહાજરીમાં તેમની કામગીરી કરવી.</li> </ul>

૧૩	પટવાળા	<ul style="list-style-type: none"> <li>ખાતાની ટપાલ લઈ જવી તથા લાવવી</li> <li>અન્ય વહીવટી કામગીરીમાં સેવા આપવી</li> </ul>
૧૪	મજુર	<ul style="list-style-type: none"> <li>કોમ્પ્યુટર સ્ટેશનરી ગોડાઉનમાંથી લાવી પ્રિન્ટિંગ માટે પ્રિન્ટર રૂમમાં આપવી</li> <li>પ્રિન્ટ થયલ સ્ટેશનરી જે તે વિભાગમાં પહોંચતી કરવી.</li> </ul>

(૩) દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યવાહી

- (એ.) જૂ.કલાર્ક ફાઈલ કે પેપર્સ તૈયાર કરી સીની.કલાર્ક સમક્ષ મૂકે છે.
- (બી.) સીની.કલાર્ક ઓફિસ સુપ્રિન્ટેન્ટ ફાઈલ કે પેપર્સ તપાસી આસી.મેનેજરશ્રી સમક્ષ મૂકે છે.
- (સી.) આસી.મેનેજર ફાઈલ કે પેપર્સ તપાસી મેનેજરશ્રી સમક્ષ મૂકે છે.
- (ડી.) મેનેજરશ્રી ફાઈલ કે પેપર્સ તપાસી ડે.ભૂનિ.કમિ.શ્રી સમક્ષ મૂકે છે.
- (ઇ.) ડે.ભૂનિ.કમિશનરશ્રી ફાઈલ કે પેપર્સ તપાસી ભૂ.કમિશનરશ્રી તરફ મંજુરી અર્થે મોકલે છે.
- (એફ.) આગળ ઉપર જરૂર હોય તો સ્ટે.કમિટીની કે સ્ટે.કમિટી મારફતે ભૂ.કોર્પો.ની મંજુરી કે નિર્ણય મેળવવામાં આવે છે.

(૪) પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો

જે-તે ખાતાની જરૂરીયાત મુજબ કોમ્પ્યુટરાઈઝેશનની કામગીરી કરાવવી.

(૫) પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ

ભૂનિસિપલ કોર્પોરેશનના નિતી નિયમો તથા બોઝે પ્રોવિન્સીયલ ભૂ.કોર્પો.એક્ટ -૧૯૪૮ ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

(૬) પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

આ વિભાગમાં અગત્યના કોઈ દસ્તાવેજો રાખવાના હોતા નથી.

(૭) તેની નીતિ અથવા તેની અમલીકરણના ઘડતરના સંબંધમાં જનતાના સત્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિધમાન કોઈ ગોઠવણાની વિગતો

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

- (૮) તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

- (૯) તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા મ્યુનિ. સેવાઓને લગતા અગત્યના ટેલીફોન નંબર

અગાઉ ઉલ્લેખ કર્યો મુજબ

- (૧૦) તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર

અનુ.નં.	હોદ્દો	ગ્રેડ
૧	મેનેજર	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૨	આસી.મેનેજર-૧, ૨	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૩	સિસ્ટમ એનાલીસ્ટ	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૪	સિસ્ટમ એન્જિનીયર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૫	જુની. પ્રોગ્રામર	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૬	જુની. સિસ્ટમ એન્જિનીયર	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૭	કોમ્પ્યુટર ઓપરેટર	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૮	ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૯	સિની.કલાર્ક	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૦	ડી.ટી.પી.ઓપરેટર/સીનીયર કલાર્ક	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૧	ટેટા એન્ટ્રી ઓપરેટર	૧૯૬૦૦-૬૩૨૦૦
૧૨	જુની.કોમ્પ્યુટર ઓપરેટર	૨૪૫૦૦-૮૧૧૦૦
૧૩	જુની.કલાર્ક	૧૯૬૦૦-૬૩૨૦૦
૧૪	પટાવાળા	૧૪૮૦૦-૪૭૧૦૦
૧૫	મજૂર	૧૪૮૦૦-૪૭૧૦૦

(૧૧) તમામ યોજનાઓ સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર

ઈ-ગવર્નન્સ ખાતુ - કોમ્પ્યુટર કોડ - ૧૧૪

સને ૨૦૨૦-૨૧ ના બજેટમાં ઈ-ગવર્નન્સ ડિપાર્ટમેન્ટની અંદાજેલ ખર્ચ

અનુ.નં.	વિગત	અંદાજેલ ખર્ચ (રૂ. લાખમાં)
૧	પગાર ખર્ચ	૫૪૦.૮૧
૨	યુનિફોર્મ	૦.૪૦
૩	ટેલીજોન તથા ટ્રાન્કલોલ (ઓફિસ)	૨૦૦.૦૦
૪	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૦.૦૪
૫	મેભરશીપ ફી	૦.૦૦
૬	સ્ટેશનરી	૭.૫૦
૭	કોમ્પ્યુટર સ્ટેશનરી	૨.૫૦
૮	પ્રિન્ટીંગ	૨.૦૦
૯	ઝરોક્ષ	૦.૧૦
૧૦	પુસ્તકો, અખભારો, સામયિકો, રમકડા	૦.૦૦
૧૧	સ્ટાફ ટ્રેનિંગ	૦.૦૦
૧૨	જૂના દસ્તાવેજોના કોમ્પ્યુટરાઈઝેશન તથા માઈકો ફીલ્મીંગ અંગેનું ખર્ચ	૧૫.૦૦
૧૩	અન્ય ખર્ચ	૨.૫૦
૧૪	કોમ્પ્યુટર	૨૧૦.૦૦
૧૫	ટેબલ તથા ખુરશી, બાંકડા, બેચ	૫.૦૦
૧૬	સીસીટીવી	૧૦.૦૦
૧૭	વર્કચાર્જ કર્મચારીના પગાર	૧૦૦.૦૦
૧૮	વાહન ખર્ચ	૦.૫૦
૧૯	સોફ્ટવેર મરામત અને નિભાવ	૫૦.૦૦
૨૦	પેટ્રોલ ડિઝલ	૩.૦૦
૨૧	ફ્લોપી	૦.૦૦
		કુલ ૧૧૪૮.૩૬

## સને ૨૦૧૯-૨૦ ના બજેટમાં અંદાજેલ વિકાસના કામો ખર્ચ

અનુ.નં.	વિકાસના કામો	(રૂ. લાખમાં)
૧	કોમ્પ્યુટર્સ	૫૦૦.૦૦
૨	સંદેશા વ્યવહારનાં સાધનો	૦.૦૦
૩	પેઈઝંગ એન્ડ મોબાઇલ	૦.૦૦
	કુલ	૫૦૦.૦૦

(૧૨) ફણવેલ રકમ અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૩) આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૪) ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો

જે માહિતી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે તેની વિગત વિભાગના કાર્યક્ષેત્રમાં જે તે કામગીરીમાં દર્શાવેલ છે.

(૧૫) જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો

આ વિભાગમાં કોઈ ગ્રંથાલય નથી.

(૧૬) જાહેર માહિતી અધિકારીઓના હોદાઓ અને બીજી વિગતો

અનં	હોદ્દો	ફરજનો સમય	ફરજનું સ્થળ	ફોન નંબર
૧	આસી. મેનેજર જાહેર માહિતી અધિકારી	સવારે ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦	સરદાર પટેલ ભવન દાણાપીઠ, અમદાવાદ	૨૫૩૮૧૮૧૧
૨	મેનેજર અપીલ અધિકારી	સવારે ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦	સરદાર પટેલ ભવન દાણાપીઠ, અમદાવાદ	૨૫૩૮૧૮૧૧

## (૧૭) દરાવવામાં આવે તેવી બીજી માહિતી

### ૪ - ગવર્નન્સ

અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પાયાની જરૂરિયાતો જેવી કે પાણી, ગટર, રસ્તા અંગેની ફરિયાદો, જન્મ-મરણની નોંધણી, બિલિંગ પ્લાન એપ્રુવલ, ગુમાસ્તાધારા હેઠળ શોખ અને એસ્ટાબ્લીશમેન્ટની નોંધણી તેમજ રિન્ચુઅલ વગેરે સવલતો પૂરી પાડવામાં આવે છે. સદર જરૂરિયાતો ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરો અને અન્ય નાણાંકીય સ્ત્રોત દ્વારા પૂરી પાડવામાં આવે છે. શહેરીજનોની સુવિધા અને સગવડતા વધારવાની સાથે સાથે કામગીરીમાં પારદર્શકતા આવે એ પણ ખૂબ જ જરૂરી છે. આ અંગે ઈન્ફર્મેશન ટેકનોલોજીનો વ્યવહાર ઉપયોગ ખૂબ જ મહત્વનો બની રહે છે. અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારશીની સંસ્થા ગુજરાત ઈન્ફર્મેટિક્સ લિ.ના સહયોગથી ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેના સંદર્ભે પણ્થમ ઝોનમાં ૧૨, પૂર્વ ઝોનમાં ૧૧, મધ્ય ઝોનમાં ૮, દક્ષિણ ઝોનમાં ૮, ઉત્તર ઝોનમાં ૧૧, દક્ષિણ પણ્થમ ઝોનમાં ૦૫, ઉત્તર પણ્થમ ઝોનમાં ૦૭, એમ ૬૪ સિવિક સેન્ટર તેમજ આર.ટી.ઓ. નું એક ટેક્ષ કલેક્શન સેન્ટર મળી કુલ ૬૫ સેન્ટર્સ કાર્યરત કરવામાં આવેલ છે. સદર તમામ સિવિક સેન્ટરને લીઝ લાઈન વડે સાંકળી લેવામાં આવેલ છે. જેથી કોઈ પણ ઝોનનો કરદાતા કોઈ પણ સેન્ટર ખાતે નાણાં ભરી શકે તેમજ ફરિયાદ નોંધાવી શકે છે. નાગરિકોને સિવિક સેન્ટર પરથી નીચે જણાવેલ સવલતો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

૧. પ્રોપર્ટી ટેક્સ કલેક્શન
૨. વ્યવસાય વેરા કલેક્શન
૩. વ્હીકલ ટેક્સ કલેક્શન
૪. બિલિંગ પ્લાન એપ્રુવલ ફી પેમેન્ટ
૫. જન્મ-મરણ નોંધણીની નકલની પ્રાપ્તિ
૬. ગુમાસ્તાધારા સટીફીકેટ
૭. હોકર્સ લાયસન્સ
૮. રાઇટ ટુ ઈન્ફર્મેશન અરજી સ્વીકાર
૯. હોલ બુકીગ
૧૦. ટેક્ષ ખાતાની અરજનો સ્વીકાર
૧૧. ટી.ડી.ઓ. ફી
૧૨. AMTS સીટી બસ પાસ
૧૩. સ્વીમીગપૂલ ફી
૧૪. લગ્ન નોંધણીની નકલની પ્રાપ્તિ

વધુમાં ઉપરોક્ત સેવાઓ પૈકી પ્રોપર્ટી ટેક્સ કલેક્શન, વ્યવસાય વેરા કલેક્શન, જન્મ-મરણ નોંધણીની નકલની પ્રાપ્તિ, હોલ બુકીગ, ટેક્ષ ખાતાની અરજનો સ્વીકાર તથા લગ્ન નોંધણીની નકલની પ્રાપ્તિ સુરક્ષિત વેબસાઈટ [www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in) દ્વારા નાગરિકોને ઘેર બેઠાં પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવેલું છે.

